

ઉધના કોલેજ (Udhna College)

S.Y.B.Com - સેમેસ્ટર 3 (Semester - 3)

બેંકિંગ - 1 (Banking - 1) - MCQ પ્રશ્ન બેંક (Question Bank)

ક્રમ	પ્રશ્ન (Question)	વિકલ્પો (Options)	સાચો વિકલ્પ
1	બેંકિંગ રેગ્યુલેશન એક્ટ કયા વર્ષમાં ઘડી કાઢવામાં આવ્યો હતો?	1. 1949 2. 1948 3. 1950 4. 1951	1
2	વ્યક્તિ બેંકનો ગ્રાહક ક્યારે બને છે?	1. જ્યારે તે નાણાં ઉપાડે છે. 2. જ્યારે તે નાણાં જમા કરે છે. 3. જ્યારે તે બેંકમાં ખાતું ખોલાવે છે. 4. જ્યારે તે બેંકની મુલાકાત લે છે.	3
3	બેંકરનો ગ્રાહક કોણ બની શકે છે?	1. પેઢી (Firm) 2. વ્યક્તિ (Person) 3. સંયુક્ત સ્ટોક કંપની (Joint stock company) 4. આપેલ તમામ વિકલ્પો સાચા છે	4
4	બેંકર ગ્રાહકનો કયા પ્રકારનો દેવાદાર (Debtor) છે?	1. સામાન્ય દેવાદાર 2. વિશેષાધિકાર પ્રાપ્ત દેવાદાર 3. સામાન્ય અને વિશેષાધિકાર પ્રાપ્ત બંને 4. આપેલમાંથી એક પણ નહીં	2
5	નીચેનામાંથી કઈ બેંકર અને ગ્રાહક વચ્ચેના સંબંધની સામાન્ય લાક્ષણિકતા છે/છે?	1. દેવાદાર-લેણદાર સંબંધ 2. બેંકરનો સેટ-ઓફ (Set-off) નો અધિકાર 3. બેંકર બેઇલી (Bailee) તરીકે 4. આપેલ તમામ વિકલ્પો સાચા છે	4
6	જ્યારે બેંકર સુરક્ષિત કસ્ટડી માટે સોનું, દાગીના અને મહત્વપૂર્ણ દસ્તાવેજો મેળવે છે ત્યારે તે _____ બને છે.	1. બેઇલર (Bailor) 2. બેઇલી (Bailee) 3. ગ્રાહક 4. આપેલમાંથી એક પણ નહીં	2
7	જો ગ્રાહકે તેના બેંક ખાતામાંથી વધુ રકમ ઉપાડી (Overdrawn) હોય તો બેંક _____ બને છે.	1. દેવાદાર (Debtor) 2. લેણદાર (Creditor) 3. a અને b બંને 4. a કે b બેમાંથી એક પણ નહીં	2
8	બેંકરનો એ અધિકાર જેમાં બેંક ગ્રાહકના બે કે તેથી વધુ ખાતાઓનું સંયોજન કરે છે, જેમાંથી એક ખાતું દેવામાં હોય અને બીજું જમા બાકી હોય, તેને શું કહેવાય?	1. સેટ ઓફનો અધિકાર (Right of Set Off) 2. લિયનનો અધિકાર (Right of Lien) 3. a અને b બંને 4. આપેલમાંથી એક પણ નહીં	1
9	મુદતનો કાયદો (Law of Limitation) કઈ સમયમર્યાદા ચોક્કસ કરે છે?	1. એક વર્ષ 2. બે વર્ષ 3. ત્રણ વર્ષ 4. ચાર વર્ષ	3
10	જો બેંકર પોતાના સેટ-ઓફના અધિકારનો ઉપયોગ કરવા માંગતો હોય તો કઈ શરત/શરતો પૂરી થવી જોઈએ?	1. ખાતું સમાન નામે હોવું જોઈએ. 2. દેવાની રકમ ચોક્કસ હોવી જોઈએ. 3. ખાતું સમાન ક્ષમતા/હોદ્દામાં હોવું જોઈએ. 4. આપેલ તમામ વિકલ્પો સાચા છે	4
11	ગ્રાહકના એજન્ટ તરીકે બેંકર શું કરે છે?	1. તેના વતી જામીનગીરીઓ (Securities) ખરીદે છે 2. તેના વતી જામીનગીરીઓ વેચે છે 3. a અને b બંને 4. a કે b બેમાંથી એક પણ નહીં	3

ક્રમ	પ્રશ્ન (Question)	વિકલ્પો (Options)	સાચો વિકલ્પ
12	જે ગ્રાહક સુરક્ષા/જામીન માટે બેંકરને વસ્તુઓ સોંપે છે તેને શું કહેવાય?	1. બેઇલર (Bailor) 2. બેઇલી (Bailee) 3. બેઇલમેન્ટ (Bailment) 4. આપેલમાંથી એક પણ નહીં	1
13	ગ્રાહકનો અધિકાર બેંકર માટે _____ બની જાય છે.	1. અધિકાર (Right) 2. ફરજો (Duties) 3. a અને b બંને 4. આપેલમાંથી એક પણ નહીં	2
14	નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કઈ કલમ મુજબ, ચેક સ્વીકારવો/ચૂકવવો એ બેંકરની ફરજ/જવાબદારી છે?	1. કલમ 29 2. કલમ 30 3. કલમ 31 4. કલમ 32	3
15	ચુકવણી માટે રજૂ ન કરવામાં આવે તો ચેક કેટલા મહિનામાં જૂનો (Stale) થઈ જાય છે?	1. 2 મહિના 2. 3 મહિના 3. 6 મહિના 4. 9 મહિના	2
16	લિયન (Lien) ના કેટલા પ્રકાર છે?	1. 1 2. 2 3. 3 4. 4	2
17	ચોક્કસ દેવું જે માલના સંબંધમાં ઉદ્ભવ્યું હોય તે માલ રોકી રાખવાના અધિકારને શું કહેવાય?	1. સામાન્ય લિયન (General Lien) 2. ખાસ/ચોક્કસ લિયન (Particular Lien) 3. રોકી રાખવાનો અધિકાર (Retention right) 4. આપેલમાંથી એક પણ નહીં	2
18	ગાર્નિશી ઓર્ડર (Garnishee Order) કેટલા તબક્કામાં લાગુ કરવામાં આવે છે?	1. બે 2. ત્રણ 3. ચાર 4. પાંચ	1
19	લેણદારની વિનંતી પર દેવાદારના બેંક ફંડને જપ્ત કરવા માટે કોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશને શું કહેવાય?	1. એટેચમેન્ટ ઓર્ડર 2. જજમેન્ટ ઓર્ડર 3. ગાર્નિશી ઓર્ડર 4. આપેલમાંથી એક પણ નહીં	3
20	કયા ખાતામાં ગાર્નિશી ઓર્ડર લાગુ પડતો નથી?	1. ઓવરડ્રાફ્ટ ખાતું 2. બચત ખાતું 3. બાંધી મુદતનું ખાતું (Fixed Deposit) 4. આપેલમાંથી એક પણ નહીં	1
21	જે વ્યક્તિ નાણાં મેળવશે તેને શું કહેવાય?	1. ડ્રોઅર (Drawer) 2. ડ્રોઈ (Drawee) 3. પેઈ (Payee) 4. આપેલમાંથી એક પણ નહીં	3
22	નીચેનામાંથી કઈ બેંકરની ફરજ/ફરજો છે?	1. ખાતાઓની ગુપ્તતા જાળવવાની ફરજ 2. ચેક ચૂકવવાની/માન આપવાની ફરજ 3. ગ્રાહકના એજન્ટ તરીકે કાર્ય કરવાની ફરજ 4. આપેલ તમામ	4
23	_____ લેણદારને દેવાદાર પાસેથી લેણી નીકળતી તમામ રકમ ચૂકવઈ ન જાય ત્યાં સુધી કબજો રોકી રાખવાનો અધિકાર આપે છે.	1. ખાસ લિયન (Particular Lien) 2. સામાન્ય લિયન (General Lien) 3. a અને b બંને 4. આપેલમાંથી એક પણ નહીં	2

ક્રમ	પ્રશ્ન (Question)	વિકલ્પો (Options)	સાચો વિકલ્પ
24	ગ્રાહક બનવા માટે નિયમિત બેંકિંગ વ્યવસાયના સ્વરૂપમાં લેવડદેવડનો ચોક્કસ ઓળખી શકાય તેવો ક્રમ કે ટેવ હોવી જોઈએ. આ વ્યાખ્યા કોણે આપી છે?	1. સર જહોન પેગેટ (Sir John Paget) 2. પીટર 3. સર થોમસ મુનરો 4. આપેલમાંથી એક પણ નહીં	1
25	જ્યારે ગ્રાહક દ્વારા નાણાં જમા કરવામાં આવે છે, ત્યારે બેંકર _____ બને છે.	1. દેવાદાર (Debtor) 2. લેણદાર (Creditor) 3. થાપણદાર (Depositor) 4. આપેલમાંથી એક પણ નહીં	1
26	બેંકર પાસે _____ કરવાની કાનૂની ફરજ/જવાબદારી છે.	1. ગ્રાહકના ચેકનું ચુકવણું કરવું 2. ગ્રાહકના ખાતાનું સેટ ઓફ કરવું 3. ગ્રાહકના બિલનું ચુકવણું કરવું 4. આપેલમાંથી એક પણ નહીં	1
27	ચેકની ચુકવણી માટેની કાનૂની ફરજ બજાવતી વખતે, બેંકરે કઈ સાવચેતી રાખવી જોઈએ?	1. ચેકની અસલિયત (Genuineness) 2. કાનૂની મર્યાદાઓ 3. ગ્રાહકની જમા બાકી (Balance) 4. આપેલ તમામ	4
28	નાણાં વસૂલ કરનાર બેંકર (Collecting Banker) ને ત્યારે જ રક્ષણ મળે છે જ્યારે તે _____ વસૂલ કરે છે.	1. ક્રોસ્ડ ચેક (Crossed cheque) 2. બેરર ચેક (Bearer cheque) 3. ઓર્ડર ચેક (Order cheque) 4. ખંડિત/ફાટેલો ચેક (Mutilated cheque)	1
29	નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કિસ્સામાં, સામાન્ય રીતે નીચેનામાંથી કઈ વ્યક્તિને સારો હક (Good Title) મળે છે?	1. ગુમ થયેલ સાધન મેળવનાર 2. યથાSub યોગ્ય ધારક (Holder in due course) 3. ચોરાયેલ સાધનનો ધારક 4. બનાવટી સાધનનો ધારક	2
30	જો ગ્રાહક શબ્દોના ઉમેરામાં એવી સુવિધા આપે કે જેનાથી કપટ/બનાવટ (Forgery) થઈ, તો નુકસાન કોના શિરે જશે?	1. ગ્રાહક 2. બેંકર 3. સપ્લાયર 4. આપેલ તમામ	1
31	બનાવટી સહીવાળા ચેકની ચુકવણીને શું ગણવામાં આવશે?	1. ચુકવણી (Payment) 2. ગ્રાહકની સત્તા વિનાની ચુકવણી 3. બેંકની સત્તા વિનાની ચુકવણી 4. ચુકવણું થયું નથી	2
32	એન્ડોર્સમેન્ટ (Endorsement/પૃષ્ઠાંકીય) દર્શાવે છે કે _____	1. પૃષ્ઠાંકન કરનાર પાસે સારો હક છે 2. પૃષ્ઠાંકન કરનારની સહી અસલી છે 3. અગાઉના પૃષ્ઠાંકનો અસલી છે 4. આપેલ તમામ	4
33	જ્યારે કોર્ટ દ્વારા ગ્રાહકના ખાતાને જપ્ત કરતો ગાર્નિશી ઓર્ડર જારી કરવામાં આવે છે, ત્યારે બેંકરને _____ કહેવામાં આવે છે.	1. જજમેન્ટ દેવાદાર 2. જજમેન્ટ લેણદાર 3. ગાર્નિશી (Garnishee) 4. ગાર્નિશર (Garnishor)	3
34	જો ગ્રાહકે એક કરતાં વધુ ચેક દોર્યા હોય અને તમામ ચેકની ચુકવણી માટે પૂરતી રકમ ન હોય, તો ચુકવણી કેવી રીતે થઈ શકે?	1. અંશતઃ ચુકવણી (Partial payment) 2. પૂરેપૂરી ચુકવણી 3. બેંકર પોતાના વિવેકબુદ્ધિથી ચુકવણી કરી શકે છે 4. ગ્રાહકની પસંદગી મુજબ	3
35	જો ચેક યોગ્ય રીતે લખાયેલ હોય અને ચુકવણી માટે પૂરતી રકમ હોય પરંતુ ચેક પર કાનૂની મર્યાદા લાદવામાં આવી હોય તો:	1. બેંકર ચુકવણી કરી શકે છે 2. બેંકર વિવેકબુદ્ધિથી ચૂકવી શકે છે 3. બેંકર ચુકવણી કરી શકતો નથી 4. આપેલમાંથી એક પણ નહીં	3

ક્રમ	પ્રશ્ન (Question)	વિકલ્પો (Options)	સાચો વિકલ્પ
36	ચુકવણી અટકાવવાની સૂચના (Stop payment instruction) કોના દ્વારા આપી શકાય છે?	1. પેઈ (Payee) 2. ધારક (Holder) 3. ગ્રાહક (Customer) 4. પૃષ્ઠાંકીય (Endorsee)	3
37	જો કોઈ વ્યક્તિ પોતાની સત્તાવાર ક્ષમતામાં સહી કરે છે અને તેનું અવસાન થાય છે, તો ચેક _____	1. નકારાશો (Dishonoured) 2. નકારાશો નહીં (Not dishonoured) 3. બંનેમાંથી એક 4. આપેલમાંથી એક પણ નહીં	2
38	નીચેનામાંથી કઈ ચુકવણીને 'યથાક્રમ ચુકવણી' (Payment in due course) ગણી શકાય?	1. ક્રોસ ચેકમાં ચુકવણી 2. રોકડ નાણામાં ચુકવણી 3. બેંકિંગ સમય પછી કરેલી ચુકવણી 4. બનાવટી ચેકની ચુકવણી	2
39	ચેકનું પ્રમાણીકરણ (Certification of cheque) _____ દ્વારા કરવામાં આવે છે.	1. ડ્રોઅર (Drawer) 2. ચુકવણી કરતી બેંક (Paying bank) 3. બંને 4. આપેલમાંથી એક પણ નહીં	2
40	જો મોટી રકમનો ચેક બેંકર દ્વારા અસ્વીકાર (Dishonour) થયો હોય અને પાછળથી તેને નાની રકમનો ચેક મળે અને બીજા ચેક માટે ફંડ હોય તો:	1. બીજો ચેક પણ અસ્વીકાર થશે 2. બીજા ચેકની ચુકવણી થઈ શકે છે 3. બેમાંથી એક પણ નહીં 4. બેમાંથી ગમે તે	2
41	બેંકર કયા કિસ્સામાં ચુકવણી કરી શકતો નથી?	1. વિશ્વાસભંગ (Breach of trust) 2. પક્ષકારનો ખામીયુક્ત હક 3. ગ્રાહકની અસ્થિર મગજની સ્થિતિ (Insanity) 4. આપેલ તમામ	4
42	વેપારી ન હોય તેવા ગ્રાહકને અપાતા વળતરના પ્રકારને _____ કહેવાય છે.	1. નામમાત્રનું વળતર (Nominal compensation) 2. ખાસ વળતર 3. વાસ્તવિક/મોટું વળતર (Substantial Compensation) 4. આપેલમાંથી એક પણ નહીં	1
43	વાસ્તવિક વળતર (Substantial compensation) માટે કઈ શરત પૂરી થવી જોઈએ?	1. વેપારને નુકસાન થવું જોઈએ 2. ગ્રાહકની ખાસ શાખને નુકસાન થવું જોઈએ 3. ગ્રાહકના કરારને નુકસાન થવું જોઈએ 4. આપેલ તમામ	4
44	ચેકમાં ફેરફાર (Alteration) માટે કોણ જવાબદાર રહેશે?	1. બેંકર 2. ચેકનો પક્ષકાર 3. ફેરફાર કરનાર વ્યક્તિ 4. આપેલ તમામ	3
45	જો ખાતું ચલાવવા માટે એક કરતાં વધુ વ્યક્તિઓ સત્તાધિકૃત હોય, તો કોઈપણ એક દ્વારા આપવામાં આવેલી પેમેન્ટ અટકાવવાની સૂચના _____ ગણાશે.	1. અમાન્ય 2. માણ્ય (Valid) 3. હકારાત્મક 4. 1 અને 3 બંને	2
46	સ્ટોપ પેમેન્ટ માટે વિનંતી કરતી વખતે, ગ્રાહકે _____ ની માહિતી પૂરી પાડવી જોઈએ.	1. ચેક નંબર 2. તારીખ 3. રકમ 4. આપેલ તમામ	4
47	જ્યારે ડ્રાફ્ટ ખરીદનાર ચુકવણી રદ કરે છે, ત્યારે તે _____ નો સંબંધ સમાપ્ત કરે છે.	1. દેવાદાર અને લેણદાર 2. ટ્રસ્ટી અને લાભાર્થી 3. બેઇલી અને બેઇલર 4. એજન્ટ અને પ્રિન્સિપલ	4

ક્રમ	પ્રશ્ન (Question)	વિકલ્પો (Options)	સાચો વિકલ્પ
48	RBI ના નિયમો મુજબ, બેંકર ચેકને કેટલા મહિના સુધી સ્વીકારી/ચૂકવી શકે છે?	1. 3 મહિના 2. 4 મહિના 3. 2 મહિના 4. 5 મહિના	1
49	જો નાણાં _____ ની ભૂલથી ચૂકવાયા હોય તો બેંકર તે વસૂલ કરી શકતો નથી.	1. કાયદાની ભૂલ (Mistake of law) 2. હકીકતની ભૂલ (Mistake of fact) 3. ગ્રાહકની ભૂલ 4. આપેલમાંથી એક પણ નહીં	1
50	નાણાં ક્યારે વસૂલ કરી શકાય?	1. હકીકતની ભૂલ હેઠળ 2. બદનિયતથી મેળવેલ નાણાં 3. મેળવનાર અને ચૂકવનાર પક્ષકાર વચ્ચેની ભૂલ 4. આપેલ તમામ	4
51	ચેકની ચુકવણીમાં કોના માટે જોખમ સમાયેલું છે?	1. ચુકવણી કરતી બેંક 2. ગ્રાહક 3. ત્રીજો પક્ષકાર 4. આપેલમાંથી એક પણ નહીં	1
52	બેંકરને થતા નુકસાનને ઘટાડવા માટે કોણ કાનૂની રક્ષણ પૂરું પાડે છે?	1. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 2. સરકાર 3. ગ્રાહક 4. આપેલ તમામ	1
53	_____ સામેનું રક્ષણ વૈધાનિક કાયદા (Statutory act) દ્વારા આપવામાં આવે છે.	1. ઓર્ડર ચેકની ચુકવણી 2. બેરર ચેકની ચુકવણી 3. ક્રોસ ચેકની ચુકવણી 4. આપેલ તમામ	4
54	ઓર્ડર ચેકના કિસ્સામાં ચુકવણી કરનાર બેંકરને રક્ષણ આપવા માટે કઈ શરત પૂરી થવી જોઈએ?	1. પૃષ્ઠાંકન નિયમિત હોવું જોઈએ 2. ચુકવણી યથાક્રમ થવી જોઈએ 3. 1 અને 2 બંને 4. આપેલમાંથી એક પણ નહીં	3
55	બેરર ચેકના કિસ્સામાં, જો ચેક ચોરાઈ જાય અને બેંકર જાણ વગર ચુકવણી કરે તો:	1. તે જવાબદાર રહેશે 2. તે જવાબદારીમાંથી મુક્ત થશે 3. તેને રક્ષણ મળશે 4. 2 અને 3 બંને	4
56	જો ચુકવણી કરનાર બેંકર અસંગત/અનિયમિત પૃષ્ઠાંકનવાળા ક્રોસ ચેકની ચુકવણી કરે છે તો તેને વૈધાનિક કાયદા દ્વારા રક્ષણ મળશે નહીં.	1. સાચું (TRUE) 2. ખોટું (FALSE) 3. બંનેમાંથી એક 4. કોઈ ટિપ્પણી નહીં	1
57	જો ચેકમાં સ્પષ્ટપણે મોટો ફેરફાર (Material alteration) જોઈ શકાતો હોય અને બેંકર ચુકવણી કરે તો:	1. તે જવાબદાર રહેશે 2. તે જવાબદારીમાંથી મુક્ત થશે 3. તેને રક્ષણ મળશે 4. 2 અને 3 બંને	1
58	જ્યારે બેંકર ભૂલથી એજન્ટને નાણાં ચૂકવે છે અને એજન્ટ તે પ્રિન્સિપલને ચૂકવે છે, ત્યારે નાણાં વસૂલ કરી શકાય છે.	1. સાચું 2. ખોટું 3. અંશતઃ સાચું 4. અંશતઃ ખોટું	2
59	જ્યારે કોઈ નિર્દોષ ધારકને ભૂલથી નાણાં ચૂકવવામાં આવે છે ત્યારે:	1. નાણાં વસૂલ કરી શકાય છે 2. નાણાં વસૂલ કરી શકાતા નથી 3. બેંક પોતાની મરજી મુજબ કાર્ય કરી શકે છે 4. અંશતઃ વસૂલ કરી શકાય છે	2

ક્રમ	પ્રશ્ન (Question)	વિકલ્પો (Options)	સાચો વિકલ્પ
60	જ્યારે કોઈ વ્યક્તિ ખોટી દાનતથી (Bad faith) નાણાં મેળવે છે, ત્યારે:	1. બેંકર જવાબદાર છે 2. બેંકર નાણાં વસૂલ કરી શકે છે 3. બેંકર નાણાં વસૂલ કરી શકતો નથી 4. બેંકરને સજા થશે	2
61	ચેકના ડ્રોઅર દ્વારા આપવામાં આવેલો સ્ટોપ ઓર્ડર કાયદેસર ત્યારે જ ગણી શકાય જ્યારે તેમાં _____ વિગતો હોય.	1. ચેક નંબર 2. રકમ 3. પેઈનું નામ 4. આપેલ તમામ	4
62	_____ એ વિનિમય પત્ર (Bill of exchange) છે જેના દ્વારા કોઈ બેંક અન્ય બેંક અથવા તેની પોતાની શાખાને ચોક્કસ વ્યક્તિને ચોક્કસ રકમ ચૂકવવા માટે કહે છે.	1. ડ્રાફ્ટ 2. બેંકર્સ ડ્રાફ્ટ 3. લેણી હૂંડી (Bill receivable) 4. 1 અને 2 બંને	4
63	ગેરરીતિઓ રોકવા માટે, RBI એ તમામ બેંકને અમુક સમયગાળાની તારીખવાળા ચેક જો સુધારો કરેલો હોય તો ન સ્વીકારવા સૂચના આપી છે:	1. 22 ફેબ્રુઆરી 2010 2. 40219 3. 38357 4. 38374	1
64	દસ્તાવેજમાં ફેરફાર નીચેના પરિબળોને કારણે થાય તો તેને માન્ય ગણવામાં આવે છે:	1. બાળક દ્વારા દસ્તાવેજ ફાટી જવો 2. ઉધર્મ/જીવજંતુ દ્વારા નુકસાન 3. અકસ્માતમાં દસ્તાવેજ બળી જવો 4. આપેલ તમામ	4
65	માન્ય અને અસરકારક બનવા માટે, ફેરફાર _____ હોવો જોઈએ.	1. પ્રમાણિત (Authenticated) 2. ડ્રોઅરની સહી હોવી જોઈએ 3. 1 અને 2 બંને 4. એક પણ નહીં	3
66	ચેક અસ્વીકાર (Dishonour) ના કિસ્સામાં, ગ્રાહક ગેરકાયદેસર અસ્વીકાર માટે બેંકર સામે _____ ના આધારે કાર્યવાહી કરી શકે છે.	1. કરારભંગ 2. બેદરકારી 3. બદનામી (Defamation) 4. આપેલ તમામ	4
67	ગ્રાહકે ચૂકવણી અટકાવવા માટે બેંકરને _____ સૂચના આપવી પડે છે.	1. લેખિત સ્વરૂપમાં 2. મૌખિક સ્વરૂપમાં 3. કોલ પર 4. એક પણ નહીં	1
68	અન્ય બેંકર પાસેથી ચેકની રકમ વસૂલ કરવા માટે ડેપ્યુટ કરાયેલ બેંકરને _____ કહેવાય છે.	1. વસૂલી કરનાર બેંકર (Collecting banker) 2. ડ્રોઈ (Drawee) 3. ગ્રાહક 4. 1 અને 2 બંને	1
69	ગ્રાહક વતી ચેક વસૂલ કરતી વખતે, બેંકર _____ તરીકે કામ કરે છે.	1. ગ્રાહકના ભાગીદાર 2. ગ્રાહકના એજન્ટ 3. બેંકના એજન્ટ 4. બેંકના કર્મચારી	2
70	જો બેંકર તેના ગ્રાહકને વસૂલાત માટે આપેલા ચેક ખરેખર વસૂલ થાય અને જમા થાય તે પહેલાં નાણાં ઉપાડવાની મંજૂરી આપે છે, તો બેંકરને _____ કહેવાય છે.	1. એજન્ટ 2. અવેજ માટે ધારક (Holder for value) 3. a અને b બંને 4. એક પણ નહીં	2
71	યથાક્રમ ધારક (Holder in due course) નો હક _____ કરતાં યડિયાતો છે.	1. ગ્રાહક 2. બેંકર 3. સાચા માલિક (True owner) 4. બેંક	3

ક્રમ	પ્રશ્ન (Question)	વિકલ્પો (Options)	સાચો વિકલ્પ
72	જો વસૂલાત માટે મોકલેલ ચેક અસ્વીકાર થાય તો વસૂલી કરનાર બેંકર _____ સામે દાવો માંડી શકે છે.	1. પૃષ્ઠાંકીય 2. ગ્રાહક 3. તમામ અગાઉના પક્ષકારો 4. 1 અને 2	3
73	જ્યારે ગ્રાહકનો ચેક વસૂલ થાય અને ડ્રોઈ બેંકર પાસેથી ખરેખર વસૂલ થઈ જાય ત્યારે વસૂલી કરનાર બેંક _____ તરીકે કામ કરે છે.	1. એજન્ટ 2. અવેજ માટે ધારક 3. 1 અને 2 બંને 4. એક પણ નહીં	1
74	રૂપાંતરણ (Conversion) એ બીજાના માલ સાથે ગેરકાયદેસર હસ્તક્ષેપ છે, અહીં 'માલ' એટલે શું?	1. ઉત્પાદનો 2. મશીનો 3. ચેક 4. મિલકતો	3
75	જો વસૂલી કરનાર બેંકર નિર્દોષ હોવા છતાં બીજાનો માલ રૂપાંતરિત કરે છે તો:	1. તે જવાબદાર રહેશે નહીં 2. તે જવાબદાર રહેશે 3. અંશતઃ જવાબદાર 4. અંશતઃ જવાબદાર નહીં	2
76	વસૂલી કરનાર બેંકરને વૈધાનિક રક્ષણ કયા પ્રકારના ચેકમાં આપી શકાય?	1. ઓર્ડર ચેક 2. બેરર ચેક 3. ક્રોસ ચેક 4. આપેલ તમામ	3
77	ક્રોસ ચેકના કિસ્સામાં, જો બેંકરને રજૂ કર્યા પછી કોસિંગ કરવામાં આવે તો:	1. બેંકરને નુકસાન સામે રક્ષણ મળશે 2. બેંકરને રક્ષણ મળી શકશે નહીં 3. બેંકર જવાબદાર રહેશે નહીં 4. બેંકર સુરક્ષિત રહેશે	2
78	જો બેંકર _____ તરીકે કાર્ય કરે તો જ રક્ષણ આપી શકાય.	1. એજન્ટ 2. ધારક 3. 1 અને 2 બંને 4. નિર્દોષ	1
79	વસૂલી કરનાર બેંકરે કઈ સાવચેતી રાખવી જોઈએ?	1. એકત્રિત નાણાં ગ્રાહક માટે હોવા જોઈએ 2. શુદ્ધ બુદ્ધિથી (In good faith) 3. બેદરકારી વિના (Without negligence) 4. આપેલ તમામ	4
80	ગ્રાહક સિવાય અન્ય કોઈ વ્યક્તિ માટે એકાઉન્ટ પેઈ ચેકની વસૂલાત કરનાર બેંકર _____	1. રક્ષણ મેળવશે 2. જવાબદાર રહેશે નહીં 3. રક્ષણ મેળવશે નહીં 4. 1 અને 2 બંને	3
81	પ્રથમ દર્શનીય (Prima facie) એટલે શું?	1. સાચું જણાય છે 2. ખોટું જણાય છે 3. પ્રથમ નજરે સાચું જણાય પણ પછી ખોટું સાબિત થાય 4. અંશતઃ સાચું અંશતઃ ખોટું	3
82	બેદરકારી (Negligence) ના મથાળા હેઠળ શું ગણવામાં આવે છે?	1. યોગદાન આપનારી બેદરકારી 2. ઘોર બેદરકારી (Gross negligence) 3. દૂરના કારણોસર બેદરકારી 4. આપેલ તમામ	4
83	જો વસૂલી કરનાર બેંકર પર પ્રો (Per pro) સહીના કિસ્સામાં સત્તાના અસ્તિત્વની ખાતરી કરવામાં નિષ્ફળ જાય, તો આ _____ નું ઉદાહરણ છે.	1. યોગદાન આપનારી બેદરકારી 2. દૂરના કારણોસર બેદરકારી 3. ઘોર બેદરકારી (Gross negligence) 4. આપેલ તમામ	3

ક્રમ	પ્રશ્ન (Question)	વિકલ્પો (Options)	સાચો વિકલ્પ
84	તપાસ કર્યા વિના ભાગીદારના ખાનગી ખાતામાં પેઢીને ચૂકવવાપાત્ર ચેક જમા કરવો એ _____ નું ઉદાહરણ છે.	1. યોગદાન આપનારી બેદરકારી 2. દૂરના કારણોસર બેદરકારી 3. ધોર બેદરકારી 4. તત્કાલ વસૂલાત સાથે જોડાયેલી બેદરકારી	4
85	વસૂલી કરનાર બેંકર જો એજન્ટ તરીકે કામ કરતો હોય તો ભૂલો અને ક્ષતિઓ માટે તે કોને જવાબદાર રહેશે?	1. બેંક 2. ગ્રાહક 3. ત્રીજો પક્ષકાર 4. સરકાર	2
86	યોગ્ય રીતે નિમણૂક કરાયેલા સબ-એજન્ટના કિસ્સામાં, બોમ્બે હાઈકોર્ટ દ્વારા નિર્દેશિત કર્યા મુજબ સબ-એજન્ટના કાર્ય માટે કોણ જવાબદાર રહેશે?	1. સબ-એજન્ટ પોતે 2. પ્રિન્સિપલ (મુખ્ય) 3. 1 અને 2 બંને 4. એજન્ટ	4
87	નાણાં ચૂકવનાર બેંકર કયા વૈધાનિક કાયદા હેઠળ રક્ષણ મેળવે છે?	1. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 85 2. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 131 3. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 120 4. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 185	1
88	વસૂલી કરનાર બેંકર કયા વૈધાનિક કાયદા હેઠળ રક્ષણ મેળવે છે?	1. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 85 2. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 131 3. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 120 4. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 185	2
89	જો બેંકર ચુકવણી કરનાર બેંકર તેમજ વસૂલી કરનાર બેંકર તરીકે કામ કરી રહ્યો હોય, તો કઈ સ્થિતિમાં બેદરકારીનું તત્વ અપ્રસ્તુત (Immaterial) બને છે?	1. એજન્ટ તરીકે 2. ચુકવણી કરનાર બેંકર તરીકે 3. વસૂલી કરનાર બેંકર તરીકે 4. આપેલ તમામ	2
90	જો બેંકર ચુકવણી અને વસૂલાતની બેવડી ભૂમિકા ભજવી રહ્યો હોય તો કઈ સ્થિતિમાં બેદરકારીનું તત્વ મહત્વનું બને છે?	1. એજન્ટ તરીકે 2. ચુકવણી કરનાર બેંકર તરીકે 3. વસૂલી કરનાર બેંકર તરીકે 4. આપેલ તમામ	3
91	જ્યારે કોઈ બેંક વસૂલાત માટે કોઈ ચેક મેળવે છે અને તે અન્ય ગ્રાહક દ્વારા તે જ બેંકનો હોય, તો બેંકરે _____ ની ફરજ બજાવવી પડે છે.	1. ચુકવણી કરનાર બેંકર 2. વસૂલી કરનાર બેંકર 3. ચુકવણી અને વસૂલી બંનેની બેવડી ભૂમિકા 4. એક પણ નહીં	3
92	નીચેનામાંથી કયો મહત્વપૂર્ણ ફેરફાર (Material alteration) નથી?	1. ક્રોસ ચેકમાં 'Not Negotiable' શબ્દો ઉમેરવા 2. ઓર્ડર ચેકને બેરર ચેકમાં ફેરવવું 3. ક્રોસિંગ દૂર કરવું 4. એક પણ નહીં	1
93	'યથાક્રમ ચુકવણી' (Payment in due course) એટલે:	1. ચેકના અંતિમ ધારકને ચુકવણી 2. શુદ્ધ બુદ્ધિથી અને બેદરકારી વિના દેખાતી મુદત મુજબ ચુકવણી 3. પ્રત્યક્ષ મુદત મુજબ ચુકવણી 4. નાણામાં ચુકવણી ન કરવી	2
94	ગ્રાહકની અસ્થિર મગજની સ્થિતિ (Insanity) ની નોટિસ મળતાં શું તમે ચેકની ચુકવણી અટકાવશો?	1. ના, કારણ કે અસ્થિરતા પહેલાં સાઈન કરી હતી 2. હા, અસ્થિરતા કારણે અંત લાવે છે 3. ના, માત્ર નોટિસ પૂરતી નથી 4. મારી પોતાની મરજી મુજબ	2
95	બેંકરે ચેકની ચુકવણી કરવાનો ઇનકાર ક્યારે કરવો જ જોઈએ?	1. ગ્રાહક બીમાર હોય 2. ગ્રાહક બહારગામ જાય 3. ગ્રાહકનું મરણ થાય 4. ગ્રાહક 2 મહિનામાં ચેક રજૂ કરે	3
96	ચેકની ચુકવણી અટકાવવાનો અધિકાર કોને છે?	1. ચેક સ્વીકારનાર 2. ચેકના ડ્રોઅર (લખનાર) 3. ચેકના ધારક 4. ચેકના પેઈ	2

ક્રમ	પ્રશ્ન (Question)	વિકલ્પો (Options)	સાચો વિકલ્પ
97	કયા પ્રકારની ભૂલથી ચૂકવાયેલા નાણાં બેંકર દ્વારા વસૂલ કરી શકાય છે?	1. હકીકતની ભૂલ (Mistake of fact) 2. કાયદાની ભૂલ (Mistake of law) 3. વસૂલાતની ભૂલ 4. આપેલમાંથી એક પણ નહીં	1
98	ચેકની વસૂલાતની પદ્ધતિ કઈ છે?	1. અવેજ માટે ધારક તરીકે 2. ગ્રાહકના એજન્ટ તરીકે 3. દેવાદાર તરીકે 4. A અને B બંને	4
99	એકાઉન્ટ પેઈ કોસ્ટ ચેકની રકમ _____	1. કોઈપણ વ્યક્તિના ખાતામાં જમા થાય 2. કોઈપણ વ્યક્તિના ખાતામાં જમા ન થાય 3. જે વ્યક્તિનું નામ પેઈ તરીકે દર્શાવેલ હોય તેના ખાતામાં જમા થાય 4. જેનું નામ હોય તેના ખાતામાં જમા ન થાય	3
100	જ્યારે ગ્રાહકના ખાતા પર ગાર્નિશી ઓર્ડર લાગુ થાય છે, ત્યારે બેંક ખાતાના વ્યવહારો _____	1. ચાલુ રાખે છે 2. મોકૂફ રાખે છે (Suspend) 3. કાયમ માટે બંધ કરે છે 4. વ્યવહારનું પુનરાવર્તન કરે છે	2
101	જ્યારે ભાગીદારી પેઢીને ચૂકવવાપાત્ર ચેક ભાગીદારના અંગત ખાતામાં વસૂલાત માટે રજૂ કરવામાં આવે, ત્યારે બેંકરે _____	1. ચેક ચૂકવવો જોઈએ 2. ચેક અસ્વીકાર કરવો જોઈએ (Dishonour) 3. ચેક રદ કરવો જોઈએ 4. ચેક ફાડી નાખવો જોઈએ	2
102	બેંકર અને ગ્રાહક વચ્ચેનો પ્રાથમિક સંબંધ _____ છે.	1. પરસ્પર 2. કરારબદ્ધ (Contractual) 3. અંગત 4. આપેલમાંથી એક પણ નહીં	2
103	જ્યારે બેંકર ગ્રાહક પાસેથી થાપણો મેળવે છે, ત્યારે બેંકર ગ્રાહકનો _____ બને છે.	1. દેવાદાર (Debtor) 2. લેણદાર (Creditor) 3. બેઇલી (Bailee) 4. ટ્રસ્ટી (Trustee)	1
104	બેંકર-ગ્રાહક સંબંધ ક્યારે સમાપ્ત થાય છે?	1. જ્યારે ગ્રાહક વિદેશ જાય 2. જ્યારે ગ્રાહક ગુનેગાર જાહેર થાય 3. જ્યારે ગ્રાહક અસ્થિર મગજનો (Insane) થાય 4. જ્યારે ગ્રાહક અકસ્માતમાં વિકલાંગ થાય	3
105	બેંકર પાસે _____ કાનૂની ફરજ છે.	1. ગ્રાહકના ચેકનું ચુકવણું કરવું 2. લિયનનો ઉપયોગ કરવો 3. ક્રેડિટ કાર્ડ આપવું 4. ડેબિટ કાર્ડ આપવું	1